

ત્વરિત જાહેરાત માટે

## આપને નિમંત્રણ છે: બ્રેમ્પટનનાં પોસાય તેવા આવાસ માટેની વ્યુહરચના (Affordable Housing Strategy)

બ્રેમ્પટન, ઓન્ટારિયો (15 ઓક્ટોબર 2019) – આપણા બાગરિકોની વિવિધ આવાસ જરૂરિયાતોને પહોંચી વળવા સીટી ઓફ બ્રેમ્પટનને તેમની પ્રથમ એફફોર્ડેબલ હાઉસિંગ સ્ટ્રેટજીના વિકાસની શરૂઆત કરતા ગૌરવની વાગણી થાય છે.

ભૌતિક, આર્થિક અને સામાજિક સુખાકારી માટે સુરક્ષિત અને ત આવાસ અનિવાર્ય છે. જોકે, બ્રેમ્પટન અને ગ્રેટર ટોરોન્ટો વિસ્તારનાં શહેરોમાં રહેવાસીઓ માટે પોસાય તેવા આવાસ મેળવવા પડકારરૂપ રહ્યું છે.

સિટી સમાજ પાસેથી મૂલ્યવાન પ્રતિભાવો મેળવવા માટે ચાર જાહેર કન્સલ્ટેશનનાં ઇવેન્ટ્સ યોજવા જઈ રહી છે. રહેવાસીઓને આલ્વાન કરવામાં આવે છે કે તેઓ હાજરી આપીને સસ્તા આવાસો અને પોતાની આવાસની જરૂરિયાતો અંગે પોતાના મત દર્શાવે.

### પબ્લિક ઓપન હાઉસ

મંગળવાર, ઓક્ટોબર 22, સાંજે 04:30 – 07:30 વાગ્યા સુધી

બ્રેમ્પટન સિટી હોલ, એટ્રિયમ (મુખ્ય માળ) (Brampton City Hall, Atrium (Main Floor))

2 વેલિંગ્ટન સ્ટ્રીટ વેસ્ટ (2 Wellington Street West)

### જાહેર વર્કશોપ #1

ગુરુવાર, ઓક્ટોબર 24, સાંજે 6 – 8 વાગ્યા સુધી

સ્પ્રિંગડેલ લાઈબ્રેરી, મલ્ટિપરપઝ રૂમ (Springdale Library, Multipurpose Room)

10705 બ્રેમલી રોડ (Bramalea Road)

### જાહેર વર્કશોપ #2

મંગળવાર, ઓક્ટોબર 29, સાંજે 6 – 8 વાગ્યા સુધી

માઉન્ટ પ્લેઝન્ટ કમ્યુનિટી સેન્ટર, પોલ હન્ટ રૂમ B (Mount Pleasant Community Centre, Paul Hunt Room B)

100 કમ્યુટર ડ્રાઈવ (Commuter Drive)

### જાહેર વર્કશોપ #3

મંગળવાર, નવેમ્બર 5, સાંજે 6 – 8 વાગ્યા સુધી

નાઈટ્સબ્રિજ સિનિયર સેન્ટર ઓડિટોરિયમ (Knightsbridge Senior Centre Auditorium)

1A નાઈટ્સબ્રિજ રોડ (1A Knightsbridge Road)

### બ્રેમ્પટનનાં આવાસ વિષયક

રિજન ઓફ પીલ સ્થાનિક આવાસ સત્તા છે જે સસ્તા ભાડાનાં એકમો પૂરા પાડે છે કે જ્યારે સિટી ભૂમિ ઉપયોગ યોજના માટે જવાબદાર છે. બંધાશે તે ભાડાના અને ઓનરશીપવાળા સસ્તા એકમોની સંખ્યા વધારવા પર *હાઉસિંગ બ્રેમ્પટન* ધ્યાન કેન્દ્રિત કરશે.

રહેવાસીઓ સાથે, આવાસ પ્રદાતાઓ સાથે, સામાજિક હિસ્સેદારો સાથે અને સરકારના તમામ સ્તરે સિટી કાર્ય કરશે જેથી "મેડ ઇન બ્રેમ્પટન"ની વ્યુલરચનાનો વિકાસ થાય જે બ્રેમ્પટનવાસીઓની આવાસની હાલની અને ભાવિ જરૂરિયાતોને સંતોષે.

સિટીની સસ્તા આવાસ વ્યુલરચના (Affordable Housing Strategy) વિશે વધુ માહિતી માટે [અમારી વેબસાઈટની મુલાકાત લો](#).

### અવતરણ

"જ્યારે આપણે આશા રાખી રહ્યા છીએ કે આપણાં શહેરની વસ્તીમાં આગામી 25 વર્ષોમાં 50 ટકા જેટલી વૃદ્ધિ થશે ત્યારે, આપણા રહેવાસીઓની સમૃદ્ધિમાં સુધારો આવે તે બાબત બ્રેમ્પટન સિટી ઓફ ઓપર્યુનિટી એટલેકે અવસર આપતું શહેર બને તે સુનિશ્ચિત કરવા માટેનો એક અતિમહત્વપૂર્ણ મુદ્દો બની જાય છે. *હાઉસિંગ બ્રેમ્પટન (Housing Brampton)* આપણા શહેરને સમાવેશિત, જીવવાલાયક અને સમાજ પર ધ્યાન આપતાં શહેર તરીકે વિકસાવવા તરફનું સાહસિક પગલું ગણી શકાય. "હું તમામ બ્રેમ્પટનવાસીઓને બહાર પડીને પોતાના મંતવ્યો દર્શાવવા આહવાન કરું છું."

-મેયર પેટ્રિક બ્રાઉન (Mayor Patrick Brown)

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રેમ્પટનમાં 650,000 લોકો વસે છે અને તમાં 70,000 વ્યાપારો છે. અમે જે કઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતા પ્રવાસનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. અહીં વધુ જાણકારી મેળવો [www.brampton.ca](http://www.brampton.ca).

**मिडिया संपर्क:**

मोनिका दुग्गल

कोऑर्डिनेटर, मिडिया अन्ड कम्युनिटी अंगेजमेन्ट

व्यूहान्मक संवाट

सीटी ओफ् ब्राम्पटन

905-874-3426 | [Monika.Duggal@brampton.ca](mailto:Monika.Duggal@brampton.ca)